

રાજકોટ મહાનગરપાલિકા
ઇ-ટેન્ડર નોટીસ (ચોથો પ્રયત્ન)

રાજકોટ મહાનગરપાલિકાનાં સભાગૃહમાં જનરલ બોર્ડમિટીંગ સમયે ટેમ્પરરી સાઉન્ડ સિસ્ટમ માટે ત્રિ-વાર્ષિક રેઇટ કોન્ટ્રાક્ટ કરવાનો હોઇ આ માટે રસ ધરાવતી તથા આ પ્રકારના કામનો પૂર્વ અનુભવ ધરાવતી પરવાનેદાર એજન્સીઓ પાસેથી ઇ-ટેન્ડર પધ્ધતિ થી પર્સન્ટેઇજ રેઇટ થી ભાવો મંગાવવામાં આવે છે.

- ૧) કામની અંદાજીત રકમ (ત્રિ-વાર્ષિક) રૂપિયા :- ૬,૨૬,૦૦૦=૦૦
- ૨) ઇ.એમ.ડી ની રકમ રૂપિયા :- ૬૨૬૦=૦૦
- ૩) ટેન્ડર ફી ની રકમ રૂપિયા :- ૧૧૨૫/- (નોન-રીફંડેબલ)

ઇ-ટેન્ડર ડાઉનલોડ કરવાની તારીખ	તા. ૦૭-૦૯-૨૧ થી તા ૨૭-૦૯-૨૧ સુધી
ઇ-ટેન્ડર ઓન લાઇન સબમિટ કરવાની છેલ્લી તારીખ	તા. ૨૭-૦૯-૨૧ સાંજનાં ૦૬.૦૦ વાગ્યા સુધી
ટેકનિકલ બિડ સબમીટ કરવાની તારીખ	તા. ૨૮-૦૯-૨૧ થી ૩૦-૦૯-૨૧.
ટેકનિકલ બિડ ખોલવાની તથા ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કરવાની તારીખ (અંદાજીત)	તા. ૦૧-૧૦-૨૧.
ઓન લાઇન પ્રાઇઝ બિડ ખોલવાની તારીખ (અંદાજીત)	તા. ૦૨-૧૦-૨૧.
ટેન્ડર વેલીડીટી પિરિયડ	૧૮૦ દિવસ

વધુ માહિતી માટે www.rmc.nprocure.com ની વેબસાઇટ પરથી વિગત મેળવવી.

- ૧) એજન્સીએ છેલ્લા સાત નાણાકીય વર્ષ દરમ્યાન આ પ્રકારની ટેમ્પરરી સાઉન્ડ સિસ્ટમ કામગીરી સરકારી કે અર્ધ સરકારી ખાતામાં પૂર્ણ કરેલ હોવી જોઇએ. જે અંગેના જરૂરી દસ્તાવેજો, વર્ક કમ્પ્લીશન સર્ટીફિકેટ, ટેકનીકલ બિડ સાથે જોડવાના રહેશે.
- ૨) એજન્સીનું છેલ્લા સાત નાણાકીય વર્ષનું સરેરાશ વાર્ષિકટર્ન ઓવર રૂપિયા :- ૩,૧૩,૦૦૦=૦૦ થી વધુ હોવું જોઇએ જે અંગે CA દ્વારા પ્રમાણીત દસ્તાવેજો રજુ કરવાના રહેશે. ટર્ન ઓવર માટે રાજકોટ મહાનગરપાલિકાનાં નિયમાનુસાર Enhance Factor લાગુ પાડવામાં આવશે.
- ૩) આ કામે ઇ.એમ.ડી. તેમજ ટેન્ડર ફીનાં ડિમાન્ડ ડ્રાફ્ટ "રાજકોટ મહાનગરપાલિકા" ની તરફેણમાં (નેશનલાઇઝડ અથવા શેડ્યુલ બેન્ક) ટેકનીકલ બીડ સાથે બીડવાનો રહેશે.
- ૪) એજન્સી GST નંબર ધરાવતી હોવી જોઇએ.
- ૫) એજન્સીએ રૂ. ૦૧ લાખ કે તેથી વધુનું નેશનલાઇઝડ કે શેડ્યુલ બેન્કનું તાજુ (ટેન્ડરની તારીખથી એક વર્ષ જુનું ન હોય તેવું) સોલ્વન્સી સર્ટીફિકેટ આપવાનું રહેશે.
- ૬) આ કામ માટે કોઈ પણ પ્રકારનું જોઈન્ટ વેન્યર માન્ય રાખવામાં આવશે નહિં.
- ૭) એજન્સીએ જરૂરી પાન (PAN) નંબર આપવાનો રહેશે.

[Type text]

- 8) અત્રેથી વર્કઓર્ડર આપવામાં આવે તે મુજબના સમયગાળામાં કામગીરી પુરી કરી આપવાની રહેશે અન્યથા રાજકોટ મહાનગરપાલિકાના નિયમ અનુસાર પેનલ્ટી કરવામાં આવશે.
- 9) આવેલ ભાવના ટેન્ડરો ખોલવામાં આવશે ત્યારે જરૂર જણાશે તો જ ભાવ ભરનાર એજન્સી સાથે વાટાઘાટ કરવામાં આવશે. અને ત્યારબાદ તેણે ઓફર કરેલ ભાવ માન્ય રાખવો કે નહી તેનો હક્ક કમિશ્નરશ્રી રાજકોટ મહાનગરપાલિકા ને અબાધિત રહેશે.
- 10) શરતી ટેન્ડર માન્ય રાખવામાં આવશે નહી.
- 11) આ કામ માટે એજન્સી કોઈ પેટા કોન્ટ્રાક્ટ કરી શકશે નહી કે રાખી શકશે નહી.
- 12) એજન્સીએ ટેન્ડરમાં સામેલ પરિશિષ્ટ મુજબનું " નો બ્લેક લિસ્ટેડ ડિકલેરેશન " નું રૂ ૩૦૦=૦૦ નાં સ્ટેમ્પ પેપર પર તાજું સોગંદનામું જોડવાનું રહેશે
- 13) જે એજન્સીના ભાવ મંજૂર થાય તેમણે સરકારશ્રીનાં નિયમોનું સાર નિયત સ્ટેમ્પ પેપર પર કરારનામું કરી સીક્યોરીટી ડીપોઝીટ તરીકે, મંજૂર થયેલ ભાવોનાં ત્રિવાર્ષિક લેખે થતી રકમના ૫ % રકમની એફ.ડી.આર અથવા બેન્ક ગેરન્ટી ૪૨ માસ માટે "રાજકોટ મહાનગરપાલિકા" ની તરફેણમાં (નેશનલાઈઝડ અથવા શેડ્યુલ બેન્ક)ની આપવાની રહેશે એફ.ડી.આર.ના કિસ્સામાં સરકારશ્રીના નિયમાનુસાર સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે સીક્યોરીટી ડીપોઝીટ ભરવામાં નિષ્ફળ જશે તો ઈ.એમ.ડી જપ્ત કરવામાં આવશે. અને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે
- 14) ટેકનીકલ બિડ કવર પર " રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડ મિટીંગ સમયે ટેમ્પરરી સાઉન્ડ સિસ્ટમ પુરી પાડવાના કામ અર્થે ત્રિ-વાર્ષિક ધોરણે રેઈટ કોન્ટ્રાક્ટ કરવાનું કામ. " (ચોથો પ્રયત્ન) તેમ લખવું તેમજ ટેકનીકલ બિડ ડોક્યુમેન્ટનું કવર સમય મર્યાદામાં નીચેના સરનામે માત્ર સ્પીડ પોસ્ટથી/રજી. એડીથી કચેરી સમય દરમ્યાન પહોંચાડવાનું રહેશે.

પ્રતિ,

એડી.સીટી એન્જીનીયર,

રોશની વિભાગ, રૂમ નં.૦૮,

બીજા માળે " ડૉ. આંબેડકર ભવન",

મધ્ય ઝોન કચેરી, રાજકોટ મહાનગરપાલિકા,

હેબરભાઈ રોડ, રાજકોટ - ૩૬૦ ૦૦૧.

- 15) ટેન્ડર ડોક્યુમેન્ટસના તેમજ કોરીજેન્ડમના દરેક પેઇઝ પર એજન્સીએ સહી સિક્કા કરવાના રહેશે.
- 16) જે એજન્સી ટેકનીકલ બિડમાં ક્વોલીફાય થશે, તેનાં જ પ્રાઈઝ બિડ ખોલવામાં આવશે.
- 17) આ કામે ભાવો ફક્ત ઓનલાઈન જ ભરવાનાં છે. આ કામે જે એજન્સી નાં ભાવ મંજૂર થશે તેઓને મંજૂર થયેલ ભાવથી એક વર્ષ બાદ ૧૦% નો વધારો તથા બે વર્ષ બાદ મંજૂર થયેલ ભાવથી ૨૦% નો વધારો આપવામાં આવશે. દા.ત. મંજૂર થયેલ ભાવ રૂપિયા ૧૦૦=૦૦ હોય તો એક વર્ષ બાદ ૧૦% નો વધારો એટલે કે રૂપિયા ૧૧૦=૦૦ નુ ચુકવણું કરવામાં આવશે તથા બે વર્ષ બાદ રૂપિયા ૧૨૦=૦૦ ! નુ ચુકવણું કરવામાં આવશે (ફક્ત સમજૂતી નાં હેતુ માટે).

[Type text]

Page 2

[Type text]

- 18) આ ટેન્ડર સંબંધિત કોઈ પણ વિવાદ ઉપસ્થિત થશે તો તે ફક્ત રાજકોટ જ્યુરીડિક્શન પુરતો મર્યાદિત રહેશે. આ કામે ન્યાયનું ક્ષેત્ર રાજકોટ જ રહેશે.
- 19) આવેલ કોઈ પણ ભાવ સ્વીકારવાનો કે તમામ ભાવ રદ કરવાનો અધિકાર રાજકોટ મહાનગરપાલિકાને અબાધીત રાખવામાં આવે છે.
- 20) ટેન્ડરની કોઈપણ શરતો અને સમજૂતીનાં અર્થઘટન માટે કમિશ્નરશ્રી, રાજકોટ મહાનગરપાલિકાનો નિર્ણય આખરી રહેશે.
આ ટેન્ડર બાબતે વધુ માહિતી અર્થે મોબાઈલ નં ૯૬૨૪૭- ૦૦૪૪૯ પર સંપર્ક થઈ શકશે.

ભાવ ભરનાર એજન્સીનો સહી તથા સિક્કો

એડી. સીટી એન્જીનીયર
રોશની વિભાગ
રાજકોટ મહાનગરપાલિકા

[Type text]